

ત્વરિત જાહેરાત માટે

બ્રેમ્પટન સીટી કાઉન્સિલે બહાલી આપી 2020 બજેટને જેમાં સામેલ છે અનામત ભંડોળ અને સતત બીજી વખતના ટેક્સ ફીઝમાં આજ દિન સુધીનો સૌથી મોટો ફાળો

સમુદાય પ્રથમ: સેવાઓમાં વધારો, ભવિષ્યની તૈયારીઓ

બ્રેમ્પટન, ઓન્ટારિયો (26 ફેબ્રુઆરી 2020) – આજે વિશિષ્ટ કાઉન્સિલ સભામાં સીટી ઓફ બ્રેમ્પટનનું 2020 બજેટને સર્વસંમતિથી બહાલી આપવામાં આવી.

આ ટર્મ ઓફ કાઉન્સિલ માટે આ સતત બીજું વર્ષ છે જ્યારે સિટીના અંદાજપત્રમાં મિલકત વેરામાં 0% વધારો ઝીંકાયો.

બજેટ સુનિશ્ચિત કરે છે કે સિટીના પ્રોગ્રામ અને સેવાના સ્તરો જાળવી રાખવામાં આવે કે વધારો કરવામાં આવે; કરારોપણોથી (લેવિ) સિટીનું ઈન્ફ્રાસ્ટ્રક્ચર જાળવી શકાય તેવા સ્તરો ચાલુ રહ્યા; અને તે કે હજુ પણ નિવેશોથી આર્થિક વિકાસ અને રોજગારના અવસરો ઊભા થયા કરે છે.

આંકડા શું કહે છે

- મંજૂર થયેલ 2020 બજેટ વેરા બિલના સિટીના હિસ્સામાં 0% પર મિલકત વેરો સ્થિર રહેશે.
- 2020 વેરા બિલમાં શું હશે? સિટીના 0.0% + પ્રાંતના 1.3% + શાળા મંડલોના 0% = 1.3% (ઘર દીઠ \$64 નો સરેરાશ)
- સિટીના કુલ પ્રચાલન ખર્ચમાં \$47 મિલિયન જેટલો વધારો થયો છે. આનું નીધિયન અસેસમેન્ટ વિકાસ, મહેસૂલ વિકાસ અને સ્ટોર્મવોટર ચાર્જ મારફત થશે.
- 2020 બજેટ \$977 મિલિયનનું અંદાજપત્ર છે, જેમાં સામેલ છે \$755 મિલિયન પ્રચાલન બજેટ ખાતે (કર્મચારીઓના પગાર, જાળવણી, યુટિલિટીઝ, અનામત) અને \$222 મિલિયન કેપિટલ બજેટ ખાતે (ખરીદી, મોટા સમારકામો અને અસ્કયામતોની રિપ્લેસમેન્ટ: માર્ગો, મકાનો વગેરે).
- સિટીના બજેટમાં સિટીની અનામત રકમમાં અન્યાર સુધીનો સૌથી ઉંચો \$110 મિલિયનનો વાર્ષિક ફાળો જેનાથી સિટીની નાણાંકીય સ્થિતિ મજબૂત બનશે.
- 2020 બજેટમાં સામેલ છે ટ્રાન્ઝિટ માટે 1% કરારોપણ (લેવિ) અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર માટે 2% કરારોપણ જેથી બસો, માર્ગો અને સવલતો જેવી અસ્કયામતોને સારી રીતે કાર્યરત સ્થિતિમાં જાળવી શકાય અને સુનિશ્ચિત કરી શકાય કે સિટીનો વિકાસ ચાલુ રહે.

આપના શહેરનું નિર્માણ – કેપિટલ બજેટના મુખ્ય મુદ્દાઓ

- આઠ ઈલેક્ટ્રિક બસો સહિત બસની ખરીદી માટે \$52 મિલિયન
- માર્ગો અને સક્રિય પરિવહન વિકાસ માટે \$41 મિલિયન

- ત્રણ વર્ષના ગાળામાં રમતગમતના મેદાનો, ટ્રેઈલ્સ અને રમતના મેદાનો માટે \$9.8 મિલિયન
- સેચુરી ગાર્ડન્સ (Century Gardens) ખાતે નવા યુથ સેંટરો અને સાઉથ ફ્લેચર્સ રિક્રિએશન સેંટરો (South Fletcher's Recreation Centres) માટે \$2 મિલિયન
- કમ્યુનિટી સેફ્ટી ઝોનમાં ફોટો રડાર માટે ત્રણ વર્ષના ગાળામાં \$650,000

સમુદાય દ્વારા આકાર અપાયો

સિટીએ 2020 ના બજેટમાં ઈમેઈલ, ફોન અને ટેલિફોન ટાઉન હોલ દ્વારા 2020 ના બજેટમાં જનતાને પોતાના અભિપ્રાયો આપવાની શ્રેણીદ્ધ તકો પૂરી પાડી જેમાં 7500 જેટલા સહભાગીઓ જોડાયા હતાં.

બજેટ સમિતિ સમક્ષની રજૂઆતો જે વિવિધ નિવાસીઓ, સંગઠનો અને હિસ્સેદારોએ કરી તેને પણ સિટીએ ધ્યાન પર લીધી.

બજેટ વિશે વધુ વિગતો માટે સિટીની વેબસાઈટ www.brampton.ca/budgetની મુલાકાત લેશો.

અવતરણો

"કાઉન્સિલે 2020 ના બજેટને મંજૂરી આપી છે જેનું પરિણામ છે કે સતત બે વર્ષ સુધી ટેક્સ ફીઝ પહોંચાડતું હોય તે બ્રમ્પટન કેનેડાનું એકમાત્ર મોટું શહેર છે. વિકસિત શહેરની જરૂરિયાતોને પહોંચી વળવા ચાલુ રાખવા બજેટમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને ટ્રાન્ઝિટ માટે વસૂલવામાં આવતા કરારોપણો (લેવિ) દ્વારા મુખ્ય રોકાણો સામેલ છે. મંજૂર થયેલા બજેટમાં શહેરના ઇતિહાસમાં અનામત ભંડોળ માટેનો સૌથી મોટો ફાળો સામેલ છે."

- પૅટ્રિક બ્રાઉન, મેયર, સીટી ઓફ બ્રમ્પટન; પ્રમુખ, અંદાજપત્ર સમિતિ

"અમારી 2020 બજેટની પ્રક્રિયા એક સહયોગ સાથેનો અભિગમ ધરાવતી હતી જેમાં 7,500 નિવાસીઓએ અંદાજપત્રની પ્રક્રિયામાં ભાગ લીધો અને અનેક નિવાસીઓએ પ્રતિનિધિ મંડળો મારફતે બજેટ કમિટીને પોતાના મતો દર્શાવ્યા. આપણી કાઉન્સિલન એવા પરિણામનું ગૌરવ છે જેનાથી સુનિશ્ચિત થાય છે કે સિટી આપણા કરદાતાઓ માટે અત્યારે અને ભવિષ્ય માટે મૂલ્યવર્ધન કરી શક્યું."

- પૉલ વિસેન્ટ, પ્રાદેશિક પરિષદ સભ્ય (રીજનલ કાઉન્સિલર)વૉર્ડ 1 અને 5, ઉપ પ્રમુખ, બજેટ સમિતિ

"મંજૂર થયેલ 2020 બજેટ વ્યૂહાત્મક રોકાણો પર ધ્યાન કેન્દ્રિત કરે છે જે ટર્મ ઓફ કાઉન્સિલની અગ્રિમતાઓ સાથે સરિખિત હોય. હું કર્મચારીગણનો આભાર માનું છું કે તેઓએ ખંતથી કાર્ય કરી એક એવું જવાબદારીઓને ધ્યાનમાં લેતું અંદાજપત્ર રચાય તે સુનિશ્ચિત કર્યું જેમાં કરદાતાઓ પ્રતિ આદર દર્શાવીને અને આવતીકાલની તૈયારીઓ કરતા રહીને આપણા નિવાસીઓ માટે ઉચ્ચ ગુણવત્તાની સેવાઓનો સમાવેશ થયો છે.

- ડેવિડ બાર્રિક, ચીફ એડમિનિસ્ટ્રેટિવ ઓફિસર (David Barrick, Chief Administrative Officer), સિટી ઓફ બ્રમ્પટન

-30-

કેનેડાના સૌથી ઝડપી વિકાસ કરતા શહેરો પૈકી એક તરીકે બ્રમ્પટનમાં 650,000 લોકો વસે છે અને તેમાં 70,000 વ્યવસાયો છે. અમે જે કંઈ કરીએ છીએ તેનો હાર્દ છે લોકો. અમને ઊર્જા મળે છે અમારા વિવિધ સમાજોમાંથી, અમે રોકાણ માટે આકર્ષણનું કેન્દ્ર છીએ અને અમે તકનિકી અને પર્યાવરણીય નવિનતા તરફ દોરી જતી યાત્રાનું નેતૃત્વ કરીએ છીએ. અમારી ભાગીદારી એવા નિરોગી શહેરના વિકાસ માટે છે જે સુરક્ષિત, ટકાઉ અને સફળ હોય. અમારી સાથે [Twitter](#), [Facebook](#), અને [Instagram](#) પર જોડાવ. અહીં વધુ જાણકારી મેળવો www.brampton.ca.

મિડિયા સંપર્ક (MEDIA CONTACT):

મોનિકા દુગ્ગલ

કોઓર્ડિનેટર, મિડિયા એન્ડ કમ્યુનિટી એંગેજમેન્ટ

વ્યૂહાત્મક સંવાદ

સીટી ઓફ બ્રમ્પટન

905-874-3426 | Monika.Duggal@brampton.ca